

ઓનલાઇન ફોર્મ ભરવા અંગેની અગત્યની સૂચનાઓ

ઓનલાઇન પદવી ફોર્મ ભરનાર વિદ્યાર્થીએ નીચે દર્શાવેલ સૂચનાઓ કાળજીપૂર્વક વાંચવી.

- જેઓ પદવી મેળવવા પાત્ર હોય અને પદવી મેળવવા ઇચ્છતા હોય તેમણે તેનું આવેદન પત્ર જરૂરી વિગતો સાથે નિયત કરેલ સમય મર્યાદામાં ઓનલાઇન ભરવાનું રહેશે.
- આ યુનિવર્સિટીની પ્રથમ/દ્વિતીય પદવી મેળવવા માટેની ફી રૂ. ૧૨૫/- નિયત કરવામાં આવેલ છે.
- વિદ્યાર્થીઓએ પદવી અંગેની નિયત કરેલ ફી રૂ. ૧૨૫/- તા.૧૫-૦૫-૨૦૧૯ થી ૧૫-૦૭-૨૦૧૯ દરમિયાન **Online Payment Gateway** દ્વારા આપ **Credit/ Debit Card** અથવા **Net Banking** દ્વારા પદવી ફી જમા કરાવવાની રહેશે. જે વિદ્યાર્થીઓ ઉક્ત દર્શાવેલ સમય મર્યાદામાં આવેદનપત્ર ભરી શકેલ ન હોય તેવા વિદ્યાર્થીઓ ફી રૂ. ૧૨૫/- દંડનાત્મક ફી રૂ. ૨૫૦/- ફી કુલ ફી રૂ. ૩૭૫/- તા.૧૬-૦૭-૨૦૧૯ થી તા.૩૧-૦૭-૨૦૧૯ દરમિયાન ઉક્ત દર્શાવેલ **Online Payment Gateway** પદવી ફી ભરી શકશે.
- નીચે દર્શાવેલ વેબસાઇટ પરથી ઓનલાઇન આવેદનપત્ર ભરી શકશે.
 1. www.saurashtrauniversity.edu
 2. <http://degree.saurashtrauniversity.edu>
- જે વિદ્યાર્થી એકી સાથે એક કરતાં વધુ પદવીઓ મેળવવા ઇચ્છતા હોય તેમણે દરેક પદવી માટે જુદા આવેદનપત્રો અને તે દરેકની જુદી ફી ભરવાની રહેશે.
- ડિગ્રી કક્ષાઓની એક્સ્ટર્નલ પરીક્ષાના ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓએ આવેદનપત્ર નિયત કરેલ ફી સાથે ઓનલાઇન ભરવાના રહેશે.
- એક વખત ફી ભર્યા પછી પરત મળી શકશે નહિ કે ભવિષ્યના હેતુ માટે અનામત રાખવામાં આવશે નહિ.
- અન્ય જરૂરી વિગતો ફોર્મમાં દર્શાવવામાં આવેલ છે

રૂબરૂ ફોર્મ ભરવા અંગેની અગત્યની સૂચનાઓ

૧. સને ૨૦૦૪ અને તે પછીના જે વિદ્યાર્થીઓના પરિણામ કોઈ કારણોસર મોડા જાહેર થયેલ તેવા વિદ્યાર્થીઓ પદવી/ડિપ્લોમાં મેળવવા ઇચ્છતા હોય તેવા વિદ્યાર્થીઓએ ઉપરોક્ત સમય ગાળા દરમિયાન યુનિ. ખાતે પરીક્ષા વિભાગમાં રૂબરૂ ફોર્મ ભર્યા બાદ પરીક્ષા પદવી વિભાગમાં રૂબરૂ ચકાસણી કર્યા બાદ જો ફી જમા કરાવેલ ન હોય તો તેવા વિદ્યાર્થીઓએ કેશ વિભાગમાં (પહેલા અને ત્રીજા શનિવાર તથા જાહેર રજા સિવાય ફી ભરવાનો સમય ૧૧ થી ૨) પદવી ફી જમા કરાવવાની રહેશે.

૨. પદવી પ્રમાણપત્રમાં સુધારો કરવાનો હોય તેવા વિદ્યાર્થીઓ માટે :-

૨:૧જે કોઈ વિદ્યાર્થીઓને અસલ પદવી પ્રમાણપત્રમાં સુધારો કરવાનો થતો હોય ત્યારે તેવા વિદ્યાર્થીને મળેલ પદવી પ્રમાણપત્રમાં જણાવ્યા અન્વયેની સેનેટસભા તારીખ થી છ મહીના સુધીનો સમયગાળો પૂર્ણ થયેલ ન હોય તેવા વિદ્યાર્થીઓએ સુધારો કરાવેલ માર્કશીટની ઝેરોક્ષ અને અસલ પદવી પ્રમાણપત્ર સામેલ રાખી પરીક્ષા પદવી વિભાગમાં જમા કરાવવાનું રહેશે અને તેવા વિદ્યાર્થીઓએ પદવી ફી તથા ઓનલાઇન આવેદનપત્ર ભરવાનું રહેશે નહીં.

૨:૨જે કોઈ વિદ્યાર્થીઓને અગાઉ મેળવેલ પદવી પ્રમાણપત્રમાં જણાવ્યા અન્વયેની સેનેટસભા તારીખથી છ મહીના સુધીનો સમયગાળો પૂર્ણ થયેલ હોય અને પદવી પ્રમાણપત્રમાં ભુલ આવેલ હોય તેવા વિદ્યાર્થીએ પણ આવેદનપત્ર ઉપરોક્ત સમય ગાળા પ્રમાણે રૂબરૂમાં ભરી તેની સાથે સુધારો કરાવેલ માર્કશીટની ઝેરોક્ષ કોપી અને અસલ પદવી પ્રમાણપત્ર બિડાણ સાથે પરીક્ષા પદવી વિભાગમાં રૂબરૂ ચકાસણી કર્યા બાદ પદવી આવેદનપત્ર માન્ય રહેશે તો તેવા વિદ્યાર્થીઓએ કેશ વિભાગમાં (પહેલા અને ત્રીજા શનિવાર તથા જાહેર રજા સિવાય) નિયત થયેલી પદવી ફી જમા કરાવવાની રહેશે.

કુલસચિવ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી